

## Visit of Minister of State for External Affairs Shri V. Muraleedharan to the Republic of the Sudan and Republic of South Sudan (October 18-22, 2021)

October 16, 2021

### રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રી વી. મુરલીધરનની રિપબ્લિક ઓફ સુદાન અને રિપબ્લિક ઓફ સાઉથ સુદાનની મુલાકાત (ઓક્ટોબર 18-22, 2021)

ઓક્ટોબર 16, 2021

વિદેશ અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી (એમઓએસ) શ્રી વી. મુરલીધરન 18 થી 19 ઓક્ટોબર, 2021 દરમિયાન રિપબ્લિક ઓફ સુદાન અને 20 - 22, 2021 દરમિયાન રિપબ્લિક ઓફ સાઉથ સુદાનની સત્તાવાર મુલાકાત લેશે. બંને દેશોની તેમની આ પ્રથમ મુલાકાત હશે.

2. તેમની સુદાનની મુલાકાત દરમિયાન, રાજ્યકક્ષાના વિદેશ મંત્રી ડો. મરિયમ અલ-સાદિક અલ-મહદી અને અન્ય મહાનુભાવો સાથે પરસ્પર હિતના દ્વિવપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરશે. તેઓ સુદાનની સાર્વભૌમ પરિષદના પ્રમુખ મહામહિમ ફર્સ્ટ લેફ્ટનન્ટ જનરલ અબ્દેલ ફત્તાહ અબ્દેલરહમાન અલ બુરહાન અને વડાપ્રધાન શ્રી અબ્દલ્લા હમડોકને મળશે. રાજ્યકક્ષાના મંત્રીની મુલાકાત દરમિયાન સુદાનમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

3. સાઉથ સુદાનમાં રાજ્યકક્ષાના મંત્રી રાષ્ટ્રપતિ મહામહિમ જનરલ સેલ્વા કિર માયાડિટને મળશે. રાજ્યકક્ષાના મંત્રી વિદેશમંત્રી અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી મેયિક એચી ડેંગ, ટ્રાન્ઝિશનલ નેશનલ લેજિસ્લેટિવ એસેમ્બલીના સ્પીકર જેમા નુનુકુમ્બા અને બીજા મહાનુભવોને મળશે. તેઓ જુબામાં ભારતીય સમુદાયને સંબોધશે અને ત્યાં ભારતીય ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરશે. રાજ્યકક્ષાના મંત્રી જુબામાં ભારતીય સેનાના ડોક્ટરો દ્વારા સંચાલિત યુનાઈટેડ નેશન્સ મિશન ઈન સાઉથ સુદાન (યુએનએમઆઈએસએસ)ની હોસ્પિટલની પણ મુલાકાત લેશે.

4. સુદાન અને દક્ષિણ સુદાન સાથે ભારત ઉખાભર્યા, મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે. સંખ્યાબંધ ભારતીય કંપનીઓ બંને દેશોમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. વર્ષોથી, ભારત સુદાન અને દક્ષિણ સુદાનના યુવાનોની ક્ષમતા નિર્માણમાં મોખરે રહ્યું છે. બંને દેશોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારતભરની સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. ભારત પાસે સુદાન અને દક્ષિણ સુદાન સાથે સાંસ્કૃતિક અને લોકો સાથેના લોકોના સંબંધો છે. આ મુલાકાતથી બંને દેશો સાથેના અમારા સંબંધોને નવી ગતિ મળે તેવી શક્યતા છે.

નવી દિલ્હી

ઓક્ટોબર 16, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.